



પરીપત્ર

વિષય : પી.જી./બી.એડ./એલએલ.બી. સેમ.-૨ તેમજ યુ.જી. સેમ.-૨ ની પરીક્ષામાં ઈન્ટર્નલ (થીયરી તેમજ પ્રાયોગીક) માર્ક્સની એન્ટ્રી શરૂ કરવા બાબત.

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ભવનના અધ્યક્ષશ્રીઓ, યુનિ. સંલગ્ન અનુસ્નાતક કેન્દ્રના પ્રોફેસર્સ ઇન્ટ્યાજશ્રીઓ તેમજ યુનિ. સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ તથા માન્ય સંસ્થાઓના વડાઓને જણાવવાનું કે, જુન-૨૦૨૨ દરમ્યાન ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા લેવામાં આવનાર પી.જી./બી.એડ./એલએલ.બી. સેમ.-૨ તેમજ યુ.જી. સેમ.-૨ ની ઈન્ટર્નલ (થીયરી તેમજ પ્રાયોગીક) પરીક્ષાઓનાં માર્ક્સની એન્ટ્રી માટેની પ્રારંભ થવાની તારીખ તથા પૂર્ણ થવાની તારીખની વિગત નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

પરીક્ષાનું નામ	એન્ટ્રી પ્રારંભ થવાની તારીખ	એન્ટ્રી પૂર્ણ થવાની તારીખ
પી.જી./બી.એડ./એલએલ.બી. સેમ.-૨	૦૩/૦૬/૨૦૨૨	૨૦/૦૬/૨૦૨૨
યુ.જી. સેમ.-૨	૨૨/૦૬/૨૦૨૨	૧૫/૦૭/૨૦૨૨

ખાસ જણાવવાનું કે,

- ઉપર્યુક્ત છેલ્લી તારીખ બાદ કરવામાં આવતી એન્ટ્રી સોફ્ટવેર સ્વીકારશે નહીં.
- ઈન્ટર્નલ માર્ક્સની એન્ટ્રી પૂર્ણ થયા બાદ SAVE કરીને જ માર્ક્સ એન્ટ્રી લોક કરવાની રહેશે. માર્ક્સની એન્ટ્રી SAVE કર્યા સીવાય માર્ક્સ એન્ટ્રી લોક કરવામાં આવશે તો તેવા સંજોગોમાં સોફ્ટવેર માર્ક્સની એન્ટ્રી સ્વીકારશે નહીં.
- ઈન્ટર્નલ માર્ક્સની એન્ટ્રી પૂર્ણ થયા બાદ જો કોઈ ભૂલ હોય તો જરૂરી સુધારો કરી, ચેકલીસ્ટની પ્રિન્ટ કાઢી કોલેજ/કેન્દ્રએ ચેકલીસ્ટની ખરાઈ કરી લેવાની રહેશે. આચાર્યશ્રી તથા વિષય અધ્યાપકશ્રીએ પ્રમાણિત કરી સહી સિક્કા સાથે વિદ્યાર્થીના ધ્યાને જાણ અર્થે નોટીસ બોર્ડ પર મુકવાનું રહેશે તેમજ કોલેજનાં રેકોર્ડ ઉપર રાખવાનું રહેશે. યુનિવર્સિટીને જરૂર જણાય તો મંગાવે ત્યારે તે નકલ પરીક્ષા વિભાગમાં જમાં કરાવવાની રહેશે.
- છેલ્લી તારીખ બાદ સુધારો કરી શકાશે નહીં અને જો ભૂલ આવેલ હશે તો પરીણામ જાહેર થયા પહેલાં દંડાત્મક ફી ભરી સુધારો કરવાનો રહેશે, યુનિવર્સિટી દ્વારા પરીણામ જાહેર થયા બાદ કોઈ પણ સંજોગોમાં ઈન્ટર્નલ માર્ક્સમાં ફેરફાર કરી આપવામાં આવશે નહીં. જેની નોંધ લેવી.
- ઈન્ટર્નલ માર્ક્સની એન્ટ્રી દરમ્યાન કોલેજ ના User Name તથા Password અપાયેલ છે તેનો જ ઉપયોગ કરવો અને તે માહિતીની ગોપનીયતા જાળવાઈ તે અંગેની જવાબદારી આચાર્યશ્રીની રહેશે જે સવિનય વિદિત થાય.

ઉપર મુજબની જાણ કોલેજના શૈક્ષણિક/બિનશૈક્ષણિક કર્મચારીઓના ધ્યાન ઉપર મુકવા અને જરૂરી વ્યવસ્થા ગોઠવવા યોગ્ય કરશોજી.

Continue...



**ખાસ નોંધ:-**

૧. ઉપરોક્ત કામગીરી માટે નોવેલ કોરોના વાઇરસ COVID-19 અંગે સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. કર્મચારીઓએ માસ્ક પહેરી (ફેસ કવર) તેમજ સામાજિક અંતર જાળવી ઉપરોક્ત કામગીરી કરવાની રહેશે.
૨. દરેક કોલેજે ઈન્ટર્નલ માર્ક્સની એન્ટ્રી કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી કોલેજનાં નોટીસ બોર્ડ ઉપર ફરજિયાત લગાવવાની રહેશે જેથી કરી ને વિદ્યાર્થીઓને પોતાના માર્ક્સમાં કોઈ ભૂલ જણાય તો કોલેજનાં આચાર્યશ્રીનો સંપર્ક કરી શકે અને તેમાં સુધારો કોલેજ દ્વારા કરી લેવાનો રહેશે ત્યાર બાદ કોઈ સુધારો કરી આપવામાં આવશે નહીં જેની નોંધ લેવી.

ડી. ડી. એમ. ચુખડીયા,  
પરીક્ષા નિયંત્રક

નં :- બીકેએનએમયુ/પરીક્ષા/૧૦૬૪/૨૦૨૨

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી,

ગવર્નમેન્ટ પોલીટેકનીક કેમ્પસ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રોડ,

ખડિયા, જુનાગઢ-૩૬૨૨૬૩

તા. ૦૨/૦૬/૨૦૨૨

પ્રતિ,

યુનિવર્સિટી ભવનના અધ્યક્ષશ્રીઓ, યુનિ. સંલગ્ન અનુસ્નાતક કેન્દ્રના પ્રોફેસર્સ ઇન્ચાર્જશ્રીઓ તેમજ યુનિ. સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ તથા માન્ય સંસ્થાઓના વડાઓ તરફ...

નકલ સવિનય રવાના:-

(૧) માન.કુલપતિશ્રી/કુલસચિવશ્રીના અંગત સચિવશ્રી (જાણ અર્થે)

(૨) આઇ.ટી. સેલ (યોગ્ય કાર્યવાહી તેમજ વેબસાઇટ પર પ્રસિધ્ધ થવા અર્થે.)

JUNAGADH

॥ તમસો મા જ્યોતિર્ગમય ॥

